

مَوْ سَوْسُ: وْسِرِ وَرُوْ سَوْرُو مُوسِوْمُ مَوْسُونُ

مِدْرُوَّ سُرُ سُرُّ مُعَالِدٌ: C-381/I-2022/29 (18/04/2022)

و مرسر المرسود	
יו בע די 0 0 יו האר בע מצמיניים מקבו בע מצמיניים	بر ؤ برُسْرِت
15 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 ×	יוק'ינק'ם ''ב
י י י י י י י י י י י י י י י י י י י	
رِدِرُوَّهُ سَرَسُرُهُ تَدُ: C-381/I-2022/ 29	1.1
ر برقوش تربر گروز: 18/04/2022	
תם בתו בתם תם כבם בישית תתתעכת הבתיים הממנה? ""	
,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0	8.1
وْرْمُورْمُ: 18/04/2022 رِيْرُ 21/04/2022 رَبُرُ عَامُرُوْرِثُونِيْرُ خَابُرُوْ وَرَبُرُ 13:00 رِيْرُ 12:00 رَبُرُ	
0 2 2 1 0 1 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0	
ם ۵ 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0	9.1
مُور: - مُرَّرِد: - قُرِوُكُو: - كَذِي:	5
ברקיפה הקנו ברנים ברנים ברנים היו היו היים היו באית התמשת בל היו היים היו באית התמשת בל היים היו באית התמשת בל	
ית'ים ' ה'כל ת ה'יל	
0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0	9.2
2 0 2 / 20	0.2
5 تُؤْسِرُ سَرَسْرُهُ ثَدِ: 7908156	
رد در و در د کو در	
رُدُ (بَرْرَوْسُ وِ دَهُ: عَدُولُو 2 (صِوْسُرْبَرَرُو وَدُورُ)	13
وُسُورُودُ وْوَرُورُ وَ وَوَرُورُ وَ وَهُورُ وَ وَرَدُرُرُو وَوَدُورُ وَ وَرَدُورُورُ وَوَدُورُ وَوَدُورُ	14
ים בת' אים אול במיל בל	40
مُرْ: لَا يَكُ رُونُو وَرُوعٍ رُبُّوتُ دِرُّ مُرْمَى وَ عِبْرِيْرُو مُرْمِرُ: 27/04/2022 مُرُفُ: هُمَ كَانِ: 11:00	18
תם כככם שתיית תפפית:	
هُرْد: نُوَادُوْدْ وَوْعِ بُرِّبُ دِوْمُرْهُوْ وَعِ مُرْدُوْ هُمِرِدْ: 27/04/2022 تُروَبُ: هُوَ كَاءِ: 11:00	20.1
﴿ وَمَا مُرْدُ مُنَا مُرْدُ وَمِرْدُ مِنْ وَمِرْدُ فَى وَرِدُ وَ كَارِدُ مُؤْمِرُهُ وَ .	24.1
י י י י י י י י י י י י י י י י י י י	28.1
ه المرتبع و دور مراس ه المراس و المراس	28.2
بُرِّهُ وَصُرْبُ مُعْرِيمُ مِعْرِيمُ مُرَدِّي مُرَدِّي مُرَدِّي مُرَدِّي مُرْدُوْمُ وَمِوْسُوَرُوْ.	30.1
י) יור כר יום או יום. פרש תפת את את בים את: -	36.1

2 0 0 0 0 0 (1)

- اً چَوْدُوْ هُوْدُوْ هُوْدُوْ جَوْدُو جَوْدُو جَوْدُو جَوْدُو جَوْدُو وَمُرْدُودُ وَجُدُودُ وَجُدُودُ وَجُودُ وَوَدُودُ وَمُرْدُودُ وَجُودُودُ عَوْدُ اللَّهُ عَادُودُ وَمُرْدُودُ وَجُودُ مُودُودُ وَجُودُ مُودُدُودُ وَجُودُودُ وَجُودُ مُودُدُودُ وَجُودُ وَمُودُودُ وَجُودُ وَمُودُودُ وَجُودُ مُودُدُودُ وَجُودُ مُودُودُ وَجُودُ وَجُودُ مُودُودُ مُودُودُ وَجُودُ وَجُودُ وَجُودُ مُودُودُ و مُودُودُ وَالْمُودُودُ وَالْمُودُ ولَالِهُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ ولَالْمُودُ وَالْمُودُ وَالْمُو
- - 2.1.1 ورور برادي د موروه عام المالي المالية والمراه المالية ال
 - 2.1.2 بُرُهُ سَمْ بِي فَالْتُرْدُى وَرُدُرُ مَنْ صَعْفِي لَمْ وَوَرِو كُرُو وَرِدُو بُرُهُ سَمْ بُوهُدُد.
- 2.1.3 كَوْمُرُجُ وْ مَضْهُ مِهِ وَ وَمُرْمَرُ وَمُرْمَرُ مُرَجِ فَهُمْ كَمْ مُورِدُو كَوْمُو كَا وَمُرْجُو وَ مَضْهُمْ مِعْمُ وَمُرُو مُرَمِّو وَمُرُو وَمُرْمُو وَمُرُو وَمُرْمُو وَمُرُو وَمُو وَمُو وَمُرُو وَمُو وَمُو وَمُو وَمُرُو وَمُرُو وَمُو وَمُو وَمُو وَمُو وَمُو وَمُو وَمُو وَمُو وَمُرُو وَمُو وَمُو وَمُو وَمُو وَمُرُو وَمُو وَمُرُو وَمُو وَمُولِ وَمُرْمُونُو وَمُوا وَالْمُوا وَمُوا وَمُوا وَالْمُوا وَمُوا وَالْمُوا و

- 3.0 هُوْسُ دُسْرَسُرُوْسُ 3.1 هُوْسُورُدُ دُسْرَسُرُوْسُ وَجِدُوْدُ عَيْوَهُوْ 1 دُرُوُّ عُوْسُ وَبُرْدُوْدُ مُوْسُوْسُ وَجِدُوْدُ عَيْوَهُوْ <math>3.1 مُرْمِوْسُ مُرْسِوْسُ مُرْمُوْسُ مُرْمِوْسُ مُرْمُوْسُ مُرْمُونُ مُرْمُوْسُ مُرْمُوسُ مُوسُ مُوسُ مُرْمُوسُ مُوسُ مُرْمُوسُ مُوسُ مُوسُ مُوسُ مُوسُ مُوسُ مُوسُ مُوسُ مُوسُ مُوسُ مُرْمُ مُوسُ مُ مُرْمُ مُوسُ مُ مُوسُ مُوسُ مُوسُ مُ مُوسُ مُ مُوسُ مُ مُسُمُ مُ مُوسُ مُ
- 3.3.1 بۇيمۇرۇھ بودھ ئىلدۇسۇنىڭ دىئى بىرى بايدىكى ئىلاھى ئىلىرى ھۇدۇرد ئۆرىدى ئىلىرى ئۇلىگىنى ئىرىدۇ دىرى ئوبۇرگىنى ھەللىنى "بۇكىدى ئۇلىرى ئالىرى ئالىرى ئالىرى ئالىرى ئالىرى ئالىرى ئ ئۆردى ئىرىدى ئىلىگىدۇ.

3.3.2 - פָשׁתֹא בִייְּבָּסְנֵיל כִּתְּבָּתָ בִּי בְּשִׁלְּאֵל בִּתְּבָּתְ בְּנִבְּתְּבְּעִר בְּנִבְּתְּלִילְ בְּצִבְּתְּבְּעִר בְּנִבְּתְּבְּעִר בְּנִבְּתְּבְּעִר בְּנִבְּתְּבְּעִר בּבְּתְבְּעִר בּבְתְבְּעִר בּבְּתְבְּעִר בּבְּתְבְּעִר בּבְּתְבְּעִר בּבְּתְבְּעִר בּבְּתְבְּעִר בּבְּתְבְּעִר בּבְּתְבְּעִר בּבְּתְבְּעִר בּבְּתְבְּעִר בּבְּתְבְּעִבְּתְרְבִּעִים בּבְּתְבְּבִּעִר בּבְּתְבְּבִּעִים בּבְּתְבְּעִבּים בּבְּתְבְּבּער בּבְּתְבְּבּער בּבְּתְבְּבּער בּבְּתְבְּבּער בּבְּתְבְּבּער בּבְּתְבְּבּער בּבּבּער בּבְּתְבְּבּער בּבּבּער בּבּער בּבּבּער בּבּבּער בּבּבּער בּבּבּער בּבּבּער בּבּבער בּבּבּער בּבּבּער בּבּבּער בּבּבער בּבּבער בּבּבּער בּבּבער בּבּבּער בּבּב

3.3.3 - ئَوْمَرُعُ وَ جَسَرَمِعُ وَنَا كُورُمِرِ يُرَسِّرُ الْمُرَوَّمُ وَمُوْدُورُ جَرِنَا مُرَّمَّرُ وَمُرَوَّمُ وَمُرَوَّمُ وَمُرَّمِّرُ الْمُرَوَّمُ وَمُرَوَّمُ وَمُرَوِّمُ وَمُرَوِّمُ وَمُرَوَّمُ وَمُرَوَّمُ وَمُرَوَّمُ وَمُرَوَّمُ وَمُرَوَّمُ وَمُرَوِّمُ وَمُرَوْمُ وَمُرَوِّمُ وَمُرَوِّمُ وَمُرَوِّمُ وَمُرَوِّمُ وَمُرَوْمُ وَمُرَوّعُ وَمُرَوْمُ وَمُرَوْمُ وَمُرَوْمُ وَمُرَوْمُ وَمُرَوْمُ وَمُرَوّعُ وَمُرَوْمُ وَمُرَوْمُ وَمُرَوْمُ وَمُرَوّعُ وَمُرَوّعُ وَمُرَوّعُ وَمُوالِمُ وَمُعْمِمُ وَمُ وَمُوالِمُ وَالْمُولِمُ وَمُوالِمُ وَمُعْمُولًا لَا مُعَالِمُ وَمُوالِمُ وَمُعَلِّمُ وَاللّمُ وَمُوالِمُ وَمُولِمُ وَمُولِمُ وَمُولِمُ وَمُوالِمُ وَمُولِمُ وَالْمُولِمُ وَالْمُعُلِمُ وَاللّمُ وَالْمُولِمُ وَاللّمُ وَالْمُولِمُ وَالْمُولِمُ وَالْمُولِمُ وَلِمُ لِلْمُ وَلِمُ لِمُ وَلِمُ لِمُ وَلِمُ لِمُ ولِمُ لِمُ لِمُعِلِمُ وَلِمُ لِمُعُلِمُ وَلِمُ لِمُعْلِمُ ولِمُولِمُ لِمُولِمُولِمُ ولَا لِمُعْلِمُ ولَا مُعِلِمُ لِمُعْلِمُ ولِمُ لِمُعْلِمُ ولِمُ لِمُعُلِمُ لِمُ لِمُعِلِمُ لِمُعِلِمُ لِمُعِلِمُ لِمُعُلِمُ لِمُعُلِمُ لِمُعِلِمُ لِمُعِلِمُ لِمُعِلِمُ لِمُعِلِمُ لِمُعُلِمُ لِمُعُلِمُ لِمُ لِمُعِلِمُ لِمُعِلِمُ لِمُعِل

3.3.4 - وَهُوَ وَهُوَ وَهُوَ مُوَكُودُ وَهُوَ مُرَّهُ وَهُمُوهُ هُوَدُو دُرَرُو وَهُوهُ مُورُدُ دُرَرُو وَهُوهُ مُورُدُ الْوَوَهُوهُ الْوَوَ مُرَوَّدُو وَهُو كُولُو مُرَاكُو وَهُولُو الْمُولُونُ الْمُؤْمِدُ الْمُؤْمُونُونُ الْمُؤْمُونُونُ الْمُؤْمِدُونُ اللَّهُ الْمُؤْمِدُونُ اللَّهُ اللّهُ اللَّهُ اللَّالِي اللَّهُ اللَّالِي اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ ال

3.3.5 - سَمُنَّامُ نَسْوُسِمُنَّارٍ، وَهُوِنَ وِدِغَ نَسْوُسِمُنَسْ هِوَوَى وِرَسْمُنَادَدِ سَمِنْمُرِمْ، عِسْوَقَرْمُ نَسْوَ وَمُرْمَارُونَ شَرِّ نَمْوَ وَمُنْارُونَ

- 4. دَرَرُ عُنَرُ هِ وَوَدُو دُرُ مُرَدُوهِ وَمُرَدُ وَمُرُونُ وَمُرَدُونُ وَمُرْدُونُ وَمُرُونُ وَمُرْدُونُ وَمُونُ وَمُونُونُ وَمُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُرْدُونُ وَمُرْدُونُ وَمُونُونُ وَمُرْدُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُرْدُونُ وَمُونُونُ وَمُونُونُونُ وَمُونُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُ وَالْمُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُ وَالْمُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُ وَالْمُ وَالْمُونُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالِهُ وَالْمُ وَالْمُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُ وَالْمُ وَالْمُ
- 5. هُوَرُدُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُور مُدُرُدُورُ دُورُ وَرَدُورُ وَرَدُرُ وَرَدُرُ وَرَدُورُ و

7. هُوَسُرُوْهُ وَدِرِوْسُ 7.1. هُوُوُ وَدُ وِرُسُرُهُ مِنْ وَرُسُرِ مِيْ وَدُوَّ وِسُمْ وَرُدُّ وَسُمْ وَرُوَّ وَرُسُمُ مَارُ ، دُوْسُوْ وَرُمُ هُمَّادُ ، دُوْسُوْ وَرُمُوْهُ مَا وَ. هُرِهُدُ هُرِهُدُ

7.1.2 موس ترزي وَيُمْوَمُونُ دِيْ اللهِ مَا مُورِدُ وَيَعْمُونُ دِيْ مُسْاوُدُ (مُونَا سُوسُرُ-2)

7.1.3 دُرُهُ مُوْوَدُ دُرُمِرِ رُرُبُ وَرُمْ وَرُمْوَدُ دُرُمِرِ مُرْبُ وَرُمُورُهُ (مُورُ مُورُورُ (مُورُ مُؤرُدُ

- - 7.1.5 مُرُهُ شَوْرُ (سُرُ سَمِيرُ 6)
- 7.1.6 وُسُورُ مُورُدُورُ وَ (سُورُ مُورُدُورُ وَ (سُورُ سُمِرُ 7)

- 9. ﴿ وَوَكَوْ يَكُوْهُ هِ هِ مَوْدُرِ وَ يَهُ وَهِمَ وَ عِيْرُ رَسَّرَسَ هُهِرَّدِ وَ يَا " عَرِفُ الْ مَرْسُ مَرْدُورُ وَسَرَدُو. وَدُودُوهُ

- 10. ﴿ وَوَرُ مُ مَرُو مُ مَرُو مُ مَرُو مُ مَرُو مُ مُرَوِدُ وَمُرَمُ مُرَوَدُو كُولُو مُ مُرُورُ مُ مُرَوْرُ مُ مُرَوِّرُ مُرَوْرُ مُ مُرَوِّرُ مُرَوْرُ مُ مُرَوِّرُ مُ مُرَوِّرُ مُ مُرَوِّرُ مُرَوْرُ مُ مُرَوِّرُ مُ مُرَوِّرُ مُرَوْرُ مُ مُرَوِّرُ مُ مُرَوْرُ مُ مُرَوِّرُ مُ مُرَوِّرُ مُ مُرَوِّرُ مُ مُرَوِّرُ مُ مُرَوِّرُ مُ مُرَوِّرُ مُ مُرَوْرُ مُ مُرَوْرُ مُ مُرَوِّرُ مُ مُرَوْرُ مُ مُرَوِّرُ مُ مُرَوْرُ مُ مُرَوّدُ مُ مُرَوْرُ مُ مُ مُرَوْرُ مُ مُورُورُ مُ مُرَوْرُ مُ مُرَوْرُ مُ مُ مُرَوْرُ مُ مُورُورُ مُ مُورُورُ مُ مُرَوْرُ مُ مُورُورُ مُ مُورُورُ مُ مُورُورُ مُ مُورُورُ مُ مُرَوْرُ مُ مُورُورُ مُ مُورُورُ مُ مُرَوْرُ مُ مُ مُرَوْرُ مُ مُورُورُ مُ مُ مُرَوّدُ مُ مُ مُ مُورُورُ مُ مُورُورُ مُ مُورُورُ مُ مُورُورُ مُ مُورُورُ مُ مُ
- 10.2 مَاكَدَر وَّحْمَرُ وَرَبِي مُرْضُونَ وَسُمْعِ مِ وَوَدَ هَمْمُونَ مُرَمِ مِرْوَدُهُ مِ وَوَدُ وَرَبُووُهُ مُورِدُورُ بُرْسُورُ بُرِنَا بِمُرْمِ وَمُرْمُونُ مُرَمِّ وَوَرَبُو وَوَرَبُورِ وَوَرَبُورُ مِنْ مُرْمُونُ مُر

(ית) סיצ'ית הארות המעלית (ית) מיצ'ית הארות המעלית

- 11. ﴿ وَوَ وَ وَ صَرَّمُ اللَّهِ ﴿ وَرَدُرُ وَ وَرَدُو وَ وَرَدُو وَ وَرَدُو وَ وَرَدُو وَ مِرَدُو وَرَدُو وَالْمُوا وَالْمُ وَالْمُوا وَالْمُوا وَالْمُوا وَالْمُوا وَالْمُوا وَالْمُوا وَالْمُ وَالْمُوا وَالْمُوا
 - 12. هِ وَوْدَكُ رِ خَشْرُمُو اللهِ اللهِ اللهِ مَا اللهِ اللهِ اللهِ اللهِ اللهُ ال

- 13. مَدُو رَمَرُوْهُ مِنْ 13.1. هِوَوَرُو وَهِا خَمَرَهُ مَدُو رَمَرُوَهُ وَهُمُ مَهُمْ مِوْهُ مِهُ وَهُو مَاهُوْهُ وَمُرْمُوْهُ وَمُرْمُوْهُ وَمُرْمُوْهُ وَمُرْمُوْهُ وَمُرْمُوْهُ وَمُرْمُونَ وَمُوْمُونَا وَمُوْمُونَا وَمُوالِمُونَا وَمُوالِمُونَا وَمُوالْمُونَا وَمُولِمُونَا وَمُولِمُونَا وَمُؤْلِمُونَا وَمُؤْلِمُونَا وَمُؤْلُمُ وَمُؤْلِمُونَا وَمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَالْمُونَا وَمُؤْلِمُونَا وَمُونَا وَمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَالْمُولِمُ وَالْمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَلِمُ وَالْمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَالْمُؤْلِمُونَا لِمُؤْلِمُونَا لِمُؤْلِمُ وَالْمُؤْلِمُ والْمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَالْمُؤْلِمُ وَالْمُؤْلِمُ والْمُؤْلِمُ والْمُؤ

- 15. ﴿ وَهُوَى وَهُوَهُ وَهُوَهُ وَهُوَهُ وَهُوَهُ وَهُوَهُ رَوَاهُمُ مِرْ مُسْرَسُرُهُ ﴿ وَسُرْسَرَاءً مُهِدِوْسُ وَهُوَهُ وَهُوهُ وهُ وَهُوهُ وَال
- 16. هِ وَدُرُورُ مُرَدِ مِنْ الْمُرَدِّ مِنْ الْمُرْدُ مِنْ الْمُرْدُ الْمُرْدُ الْمَدِ وِالْمُرْمَدُ وَثَهُ اللَّهُ اللَّ
 - مِرْشُرَهُ مُرْدُ عُثْرُ وَرِدً عُثْرُورِكُ جُوسٌ رُمَرَةً وَوْ
- 16.1.2 تَسْرُوْسِ/بُرُهُ سَرَمِدِهُ مِنْ مَرْمِ مِنْ مِنْ مَرْمَ مِنْ مَنْ مَرْمِرُ مَنْ مَنْ مِنْ مَعْ مِنْ عَلَمْ مَنْ مَعْ مَعْ مِنْ مُعْ مِنْ مَعْ مِنْ مَعْ مِنْ مُعْ مِنْ مَعْ مِنْ مُعْ مِنْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مَعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْمِدُ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْمِدُ مِنْ مُعْ مِنْ مُونِ مُونِ مُعْ مِنْ مُعْ مُعْ مِنْ مُعْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مِنْ مُعْ مِنْ مُعْ مُعْمِ مُعْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مُعْمِ مُعْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مُعْ مِنْ مُعْ مُعْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مُعْ مِنْ مُعْ مُعْ مُعْ مِنْ مُعْ مُعْ مِنْ مُعْ مُعْمِ مُعْ مُعْ مُعْ مُعْ مِنْ مُعْ مُعْ مُعْ مِنْ مُعْ مُعْمِ مُعْ مُعْمِ مُعْ مُعْ مِنْ مُعْ مِنْ مُعْ مِنْ مِنْ مُعْ مُعْمِ مُعْ مُعْمِ مُعْ مِنْ مُعْ مُعْمِ مُعْ مُعْمِ مُعْ مُعْمِ مُعْ مُعْمِ مُعْ مُعْمِ مُعْ مُعْمِ مُعْمِ مُعْ مُعْمِعْ مُعْمِ مُعْ مُعْمِ مُعْمِ مُعْ مُعْ مُعْمِ مُعْمُ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْمُ مُعْمِ مُعْمِ مُعْمُ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْمُ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْمُ مُعْمِعُ مُعْمُ مُعْمِ مُعْمِ مُعْمِعُ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْمِ مُعْمُ مُعْمِ مُعْمِ مُعْمُ مُعْمِ
 - 16.1.3 تُوبِرَرُوَنَكُرُورِهُ صِوْسُرُ رَبِرَزَةً وَبُرُونُ وَيُرْوَدُ
- - 16.1.5 مِنْ سُمِرِمِ مُرْرَكِسُ فِي مُورُدُسُونَ مُرْزِعٌ مِنْ سُمِي
- 16.2 ﴿ وَمُورُ رُمُرُرُورُ مِهِ يَدِدِوُ وَدُرُورُكُمْ دُورٍ وِلْدُورُ دُورٍ وِلْمُرْمَدُ وَثَوْ سُرَوَهُ سُرَّهُ مُرَدُ . وَمُرْبُ سُرُوعُ سُرُوعُ سُرُوعُ سُرُوعُ سُرُوعُ سُرُوعُ وَدُرُورُكُمْ دُورِ وِلْمُؤْدُ دُورِ مِلْمُعْرَدُ وَ
- 16.2.1 ﴿ وَمَرْزُو وَمَرْزُو وَ مَرْزُو وَ مَرْدُو وَ مَرْدُو وَ مَرْدُو وَ مَرْدُو وَ وَمُرْدُو وَمِرْدُو وَ وَمُرْدُو وَ وَمُرْدُو وَ وَمُرْدُو وَ وَمُرْدُو وَ مُرْدُو وَ وَمُرْدُو وَ وَمُرْدُو وَ مُرْدُو وَ مُرْدُونُ وَالْمُودُ وَمُرْدُونُ وَالْمُودُ وَمُرْدُونُ وَالْمُودُ وَالْمُودُ وَمُرْدُونُ وَالْمُودُ وَمُرْدُونُ وَالْمُودُ وَالْمُودُ وَمُرْدُونُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُؤْدُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُؤْدُ وَالْمُؤْدُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُؤْدُ وَالْمُؤْدُ وَالْمُؤْدُ وَالْمُودُ وَالْمُؤْدُ وَالْمُودُ وَالْمُؤْدُ وَالْمُؤْدُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُو
 - 16.2.2 مِوَسُ رَمَرَةً وَمُرْهَدُ وَيْرِ مَرِوْ وَبِرَوَ كَانْهُوَدُورُ رَمَرَوَسُوهُ
- (م) مردم ترکور و مروم و مروم و کرس هوش (مرکورو) مروکره درورو درور

- (س) ئُرِدُو وَرُدُ صَّرَنَا صَوْمَتُ مُوْرِدُ دِسِرِيْسَرُسِ صَّرَنَا بِرِيُمَرْسُ سِعِ در شرور صَرِدَ صَرِنَا مِنْ وَمَرْدُ شَرِيْسُ وَسَرَدُونَ وَرَرَا مِنْ وَسَرَدُونَ اللَّهِ اللَّهُ اللّ
- 16.2.3 مُرْدُةُ مُرْدُورُ مُرِدُورُ مُرْدُورُ مُرُدُورُ مُرْدُورُ مُرُدُورُ مُرْدُورُ مُرِدُورُ مُرِدُورُ مُرْدُورُ مُرْدُورُ مُرْدُورُ مُرْدُورُ
- (عر) رَسْرَيْ مَيْعَ عَرْمُوسُ مَنْ رُّدُ الْمَاثِ وَيَعْرَفُ مُعْرِ وَرَبِيْ مَعْرُ وَرَبِيْ وَرَدُو مِعْ مُدُمَدُوْدُهُ وَسُرُوسُهُوْ.
- (س) دِ بَرْ وَبَرْسُ حَوْرِ وَبِرْخَ رَحَوَّ مَرَسُ، وَرِحَّ دُرَوْرَ، سِمِ وَرَدْبَرُوْسُ مُبِرِدُ، لَابْرِعُوْدُ سِمِعِ دُورُورُو رُدُوسُ مُبِیرِدُ رَدِ بِرُوبُسُ وَرُلْدُ وَبُرُورُ سُرُدُرِ سِمْرِ رُدِ سِعُورُ الْوَرْسُ رُسِوْسُ دِسْرَسُولُوسُرَدُوْ.
- (*) و پروُ بَرْسُ و وُسُرُوسِ پروُ بَرْسُ وَدَّهِ وَبُرُوسُ وَدَّبِ وَبُرُوسُ وَدَّبِ بَرُوْسُ وَلَا وَرُولُو وَ دَبِرِي سَرُوْ پروُمُرُسُ اللهِ وَرُولُو بِرُورُسُ اللهِ وَرُدُو لِهُ مِنْ اللهِ وَرُدُولُ سِرْدُسُوسُرُووْ.
- 16.3.1 وَوْءِ وَهُ مِسْرَوْسٌ مَوْسِرِهُ هَيْ مِعْسِ ثَرْنَدُ عَاهُ مَوْمِدُهُ مِرْقُوهُ مَا إِلَيْ اللهِ مَا مُورَعُسُ مِرْقُوهُ مَا إِلَا اللهُ الل
- 16.3.2 اَدُوْرُوْرُوْ بُوسْ مَاسُ وَرِسُ مَرُدُنَّ مُوْدُ بِهِ (وَوَرُبَحَ نُوسْ مُعْرَوَ سُرُهُ مَا وَرُدُ اللهِ اللهِ اللهِ اللهُ ال

(بر) ہوس رسرروس

- 17. ﴿ وَهُو مُعْرِقُو مُعْرِضُ 17.1 ﴿ وَمُو مُعْرِضُونُ مِ مُعْرَقُو مُعْرِفُونَ وِعْرَسُونُ مِ وَوَدُدُ مَ وَمُدُرُ شَرَّهُ وَعُرَدُونَ وَعُرَّمُ وَمُودُونَ وَعُرَّمُ وَمُودُونَ وَعُرَّمُ وَعُرَدُونَ وَعُرَّمُ وَعُرَدُونَ وَعُرَّمُ وَعُرَدُونَ وَعُرَّمُ وَعُرَدُونَ وَعُرِيعُ وَمُودُونَ وَعُرِيعُ وَمُودُونَ وَعُرِيمُ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرَدُونَ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرِدُونَ وَعُرَدُونَ وَعُرِدُونَ وَعُرَدُونَ وَعُونَا وَعُمُونَ وَعُمُونَ وَعُرَدُونَ وَعُرَدُونَ وَعُرَدُونَ وَعُرَدُونَ وَعُرَدُونَ وَعُرَدُونَ وَعُونَ وَعُرَدُونَ وَعُونَا وَعُونَا وَالْعُونِ وَعُونَا وَالْعُونَ وَعُونَا وَالْعُونَ وَعُونَا وَالْعُونَ وَعُونَا وَالْعُونَ وَالْعُونَا وَالْعُونِ وَالْعُونَا وَالْعُونِ وَالْعُونَا وَالْعُونِ وَالْعُونَا وَالْعُونِ وَالْعُونَا وَالْعُونِ وَالْعُونَا وَالْعُونِ وَالْعُونَا والْعُونِ وَالْعُونَا وَالْعُونَا وَالْعُونِ وَالْعُونَا وَالْعُونَا وَالْعُونَا وَالْعُونَا وَالْعُونَا وَالْعُونَا وَالْعُونَا وَالْعُونَا وَالْعُونِ وَالْعُونِ وَالْمُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونَا وَالْعُونَا وَالْعُونَا وَالْعُونَا وَالْعُونِ وَالْعُونِ وَالْعُونَا وَالْعُونَ وَالْعُونِ وَالْعُونَا وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونَا وَالْعُونِ وَالْعُونَا وَالْعُونَا وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُلِي وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ وَالْعُونِ
- .17.2 سِمْ دَهُرُدُ صُهُوَدُ مِوْدُ سُرَسُ وِرَوُدِ دَهُرَسُرُوْ رَدُو (سِمْ دَهُرُدُ صُهُوَدُ) مُوَدُرُو صُهُرَدُو) مُوَدُرُو مُورُورُ 10 مَدِ وَسُرَدُو)
- 17.3 سوچ دُهُرِدُ مَسَّمْ وَمُهُمْ وَمِ مَسْرَدُهِ صِوْسٌ دُرَرَةً وَمُنْهُدُ سَرَّهِ دُيْمُ مُرْ وَسُرُ
- 17.4 (مَرْزَةٌ صِوْسُرُهُ (سُرْسُرُسُرُهُ مِنْ هَسُرُمُرُنْمُ وِ وَرِدُو سِمِ مِهُرَدُدِ مِ وَسُرْ مَصْفَى دَرُو دُورُو اللهِ اللهِ
- 18. ﴿ وَمَرْ رُمَرُ وَوَ وَ اللَّهِ مَرْ مَرَهُ مَرْ مُرَّهُ مُرْدُو مَرْدُ مُرْدُو مُرْدُ مُرْدُو مُرْدُو مُركَا مُركَا مُرْدُو مُركَا مُركًا مُركَا مُركَ

18.2 و دُردُرُدُ دُرُدُ و مُرَّسُرْنَهُ و وَرَوَّ مَّهُرِنَا سَمُرَانَهُ صَالْمُوْ وَرَدُهُ دُوْدُرُ وَمَرَانُ سَمُرَانُهُ و مَرْنَا مُرْفُ وَرُدُ وَمُرَانُو وَرَدُو وَرَدُو

18.3 رِوْرُوْ رُورِ وْرْبُ رِسْ وْرْرُوْ رُسْرُوْبِ رِسُوْمُورْ هُوُرُدُ سْرَوْسُورُو.

19. ﴿ وَهُ وَهُو وَ وَهُ هُ وَهُ هُ رَمُ رَوْدُو مُ رَوَدُو وَهُو وَهُ الْمُودُونِ وَهُ وَهُ وَهُ هُ وَهُ وَهُ وَمُرْدُو وَهُ وَهُو وَهُ وَهُ هُو مُرِدُونُ مِنْ وَمِرْدُونُ وَمُرَدُونُ وَمُرَدُونُ وَمُرُدُو فَهُ وَمُرُدُ وَمُرْدُونُ وَمُرْدُونُ وَمُرْدُونُ وَمُونُونُ مِنْ وَمِرْدُونُ وَمُرْدُونُ وَمُرْدُونُ وَمُرْدُونُ وَمُرْدُو

(۵) ورس روور رووره مرسو

20. ﴿ وَمَ رَوْوَرُ رَوَعَ رِوَرُوسِ هِ وَسَرَرَرُو وَ وَسَرَرَرُو وَ مَ وَرَدُرَرُو وَ مِ هِ وَسَرَرَرُو وَ وَرَدُورُ وَوَ مِنْ وَمَوَ وَرَوَ وَرَوَ رَوَعَ رِوَرُوسِ هِ وَسَرَرَرُو وَ وَرَدُو وَرَوْ وَرَا وَرَوْ وَرَوْ

20.2. ﴿ وَمُرْدُوْوُهُ كُرُهُ مُرْسُرُ مِ وَوَهُ مُوْمُوهُ وَهُوَ مُؤْمِرُ وَمُوْ الْمُؤْمُرُونُ وَوَكُر

20.3 و وَسُرْدَوْوَدُ رَدَحَ رَسُوْرُو وَهُمْ رَدُوْرُدُو مُ مَوْرُو مُ مَوَوَدُوْرُدُو هُرُدُو وَرُدُو وَرُدُو خَوْدُدِ رَدُحُ رُسُرِدِ مِرْدُ وَجُرُسُ رَدُوْسُرُدُسُرُسِ غَرِدُسُرُسُرُ مُصَوِّدُوْرُدُو جُرُسُ سَوْعُ دَدُو صَمْدُعَ دَدُوْ.

21. (رَرَرَ عُ هِ وَ ذَهِ رِهِ قَ مَهِ مِرْ رَدَةً هُ وَمِرْ رَدَةً هُ وَهِ مَهُ مَهُ وَ دَهُ مَوْدَهُ هُ وَهُ مَرَدَ وَ هُ وَهُ مَهُ وَدَهُ وَهُ مَهُ وَهُ وَهُ مَهُ وَدَهُ وَهُ مَهُ وَهُ مَا وَهُ وَهُ مَهُ وَهُ مَهُ وَهُ مَوْ وَهُ مَهُ وَهُ مَا وَهُ مَهُ وَهُ مَا وَهُ مَا وَهُ مُ مُؤْمُ مُ وَهُ مُ مُوادِدًا مُوادًا مُوادً

21.2 ﴿ وَوَدَرِهُ وَرِسَاءُ مَوَرَّرِ وَوْرٍ هَرْشَ وِهُ وَرِهً وَرَسَّهُ مَوَرَّهُ هَوَّهُوَّسُوَ، مَدَادُ وَرَسَّهُ مَوَرُهُ وَرَسَّهُ مَوَرُوهُ وَرَسَّهُ مَوَرُوهُ.

22. ﴿ وَمُرْمَدُ مُوثِدُ مُؤْدُدُ مُعَامِدُونَ مُعِرِدُ مُعَامِدُونَ مُعِرِدُ مُعَامِدُ وَمِرْدُونَ عُوسُدُونَ

12706

22.1.1 ﴿ وَرُورُ مُسْارِثُهُ أَوْبِرُرُورٌ وَيُرْبُورُ اللَّهِ اللَّهُ اللَّهُ اللَّهِ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهِ اللَّهُ اللَّهِ اللَّهُ اللَّالِي اللَّهُ اللَّالِي اللَّهُ اللَّهُ اللَّهُ الللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ ال

22.1.2 (مَرْزَوْرُونُ لِوَرْسُورُ (مَرْزَوُورُو وَيُعْرُورُسُ

036/ 14/2/2V

22.1.3 פּרָכּצֹתְפּ הְשִּקְבּמִעְפּרָתְ העֹעְצִיתִפּ פְּגַתְפּ (צִישְּבָּעִיקְפּעִים)

- 24. ﴿ وَمُرْرَقُوْنَا مُنَا لَا £ . ﴿ وَهُوْنَا مُنَا لَا وَمُنَا وَمُنَا لَا مُنَا لِهُ وَمَا لَا وَمَا وَمَا الْمَالِمُونَ وَمُرَا وَمُنَا وَمُنَا وَمُنَا وَمُنَا وَمُنَا وَمُرَا وَمُنَا وَمُنْ وَمُنَا وَمُنَا وَمُنَا وَمُنَا وَمُنَا وَمُنَا وَمُنَا وَمُنَا وَمُنْ وَمُنَا وَمُنْ وَمُنْ وَمُنْ وَمُنْ وَمُنَا وَمُنْ وَمُ وَمُنْ وَالْمُومُ وَالْمُنْ وَمُنْ وَمُنْ وَمُنْ وَمُنْ وَالْمُنْ وَمُنْ والْمُنْ وَالْمُنْ وَمُنْ وَمُنْ وَالْمُ وَالْمُنْ وَالْمُنْ وَالِمُ وَالْمُنْ وَالْمُوا مُنْ وَالْمُنْ وَالْمُنْ وَالْمُنْ وَا
- 25. 36.
 - 26. ﴿ وَمَوْ مَا وَ رَقَّهُ مَا يَكَ . كَانَ وَ رَقَّهُ وَ وَكَانَهُمُ مَا مَا وَرَقَّهُمُ مَا مَا وَرَوْهُ وَكَانَهُ وَوَكُوهُ وَكُلُوهُ وَكُولُوهُ وَكُلُوهُ وَكُلُوهُ وَكُلُوهُ وَكُلُوهُ وَكُلُوهُ وَكُلُوهُ وَكُلُوهُ وَلِمُوالِكُونُ وَكُلُوهُ وَكُلُوهُ وَكُلُوهُ وَلِلْمُ وَاللَّهُ وَاللَّهُ وَلِلْمُ وَاللَّهُ وَلِلْمُ وَاللَّهُ وَلِلْمُ وَلِمُواللَّهُ وَلِلْمُ وَلِمُواللَّهُ وَلِلْمُ وَلِمُ وَلِلْمُ وَلِلْمُ وَلِمُ وَلِمُ وَلِلْمُ وَلِمُ وَلِمُ وَلِمُ وَلِمُ وَلِلْمُ وَلِمُواللَّهُ وَلِلْمُ وَلِمُ وَلِلْمُ وَلِمُ وَلِمُ وَلِمُ وَلِلْمُ وَلِمُ وَلِمُ لِللَّهُ وَلِلْمُ وَلِمُ لِللَّهُ وَلِمُ لَا لَا لَا لِللَّهُ وَلِمُ لِلللَّهُ وَلِلَّا لِلللَّا لِلللَّهُ وَلِلْمُ لِلللَّهُ وَلِلْمُ لِلللَّهُ وَلِمُ لِلللَّهُ وَلِلْمُ لِلللَّهُ وَلِلْمُ لِلللَّهُ وَلِلْمُ لِلِمُ لِلللَّهُ وَلِلْمُ لِلللَّهُ لِلللَّهُ لِللللَّهُ وَلِلْمُولِ لِللللَّهُ وَلِلللَّهُ لِللللَّهُ لِلللَّهُ لِلللّّهُ لِللللّ واللَّهُ لِلللللَّالِمُولِلِهُ لِللللللَّالِمُ لِللللللَّالِمُولِ لِلللللَّالِمُولِلِلللللللَّالِمُ لِلللللَّ
- 27. مُدُهُ الْحَوْدُ وَ الْحَرَّ الْحَرْ الْحَرَّ الْحَرْ الْحَرْ
- 27.2 . 27.2 مُرَّسُ کَرْوَرُو کَوْوَوْمِ رُوْدُوَرُو دُرُ دُرُونُو کَرُ کَرُودُو کَرِ جَرِیْرَنَکُرُورُوسُونَ جِ دُسَادُمُ رُونِکُورُ سِرِسُرُو وَرِوْ سِرِسُرُونُ صَّمُونِکُودُ وَ دِرْمِوْکُو وَکُرُودُ وَمِرُونُکُورُ جِهِ وَسُودُونُ

- 28. و يُ سَمِر مِن مُرَرُدُودُ لَهِ مِنْ رَمَرُدُودُ لَهِ مِنْ مَرْرُدُودُ لَهِ مِنْ مِنْ مِنْ مَا مُرَادُودُ لَهِ مِنْ مُرْدُودُ لَهِ مِنْ مَرْدُودُ لَهِ مِنْ مُرْدُودُ لَهِ مِنْ مُرْدُودُ لَهِ مِنْ مُرْدُودُ لَهِ مِنْ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَهُ مِنْ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَالْمُ لَعْلَمُ لَعْلَمُ لَعْلَمُ لَمُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَهُ مُرَادُودُ لَهُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَالْمُ مُنْ مُرْدُودُ لَا لَمُ مُرْدُودُ لَهُ مُرْدُودُ لَالْمُ لَعُلِيلًا لِمُودُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلِمُ لِلْمُ لِلِمُ لِلْمُ لِ
- 28.2 عِنْ سَمِرْمِرِعِيْ وَدُورَمُرِهِ عِنْ رَدُو لَمُ مُرَاسُ وَبِرِيْسُ 30 (مِيرِثُ) مُرَوَّرُوْ.

- 29. مُهُ وَمَرْ وَرِدً 29.1 مُهُ وَمُرْدًا كَوْوَكُورُو مُرَدِ وَمَرَدَهُ وَرَدُوهُ وَ وَرِدَهُو وَ وَرَدَهُو وَ وَرَدَهُو وَدَوَهُو وَدَوْهُو وَدَوَهُو وَدَوَهُو وَدَوَهُو وَدَوَهُو وَدَوَهُو وَالْحَاءُ

- 29.4 دُوْرُوْرُ (رَرَوُرُورُ دُوْرُورُ دُوْرُورُ وَرَرَوُرُورُ دُورُورُ وَرُرُورُو وَدُورُ وَمُورُورُ وَرُرُورُورُ وَرُرُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُورُ وَرُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُورُورُ وَرُورُورُ وَرُورُورُ وَرُورُورُ وَرُورُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُرُورُورُ وَرُورُورُ وَرُورُ وَالْمُرُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُرْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُورُ وَال
- .29.5 دَهُ وَسَرَّهُ وَرَسَّهُ وَمَوْدَ وَسَرَّهُ وَسَرَّهُ وَهُوْ دَوْدُ دَوْدُ دُوْدُ دَوْدُ دُودُ دَوْدُ دُودُ دَوْدُ دُودُ دَوْدُ دَوْدُ
- 30. ۽ پُر پُوٽر سُن ۽ ڪَٽِر مُرَرُءُ مَدَرُ مَرَرُءُ مَدَرُ مَرَرُءُ مَدُ مَرَدُ مِرَدُ مِرْدُ مِرَدُ مِرْدُ مِرَدُ مِرَدُ مِرَدُ مِرَدُ مِرَدُ مِرَدُ مِرَدُ مِرَدُ مِرْدُ مِرَدُ مِرْدُ مِرْدُ مِرْدُ مِرَدُ مِرْدُ مِرْدُولِ مِرْدُولُ مِرْدُ مِرَدُ مِرْدُ مُ
- 30.2 گِندُوْرُسُ دُنْرُمُ وَمُرْمُ وَرُ وَمُورُ وَمُورُ مُورُ رُورُوْرُهُ وَمُورُوْرُ وَوَ وَدُورُوَدُ وَرُورُونُ مُرَدُرُ وَدُنْرُورُ وَرُورُورُ مُرَدُرُ وَرُورُورُ مُرَدُرُ وَرَامُورُ وَرُورُورُ مُرَدُرُ وَرَامُ وَرُورُورُ مُرَدُرُ وَرَامُ وَرُورُورُ مُرَدُرُورُ مُرَدُمُ وَرُورُورُ مُرَدُمُ وَرُورُ مُرَدُمُ وَرُورُ مُرَدُورُ وَرُورُ مُرَدُمُ وَرُورُ وَرُورُ مُرَدُمُ وَرُورُورُ مُرَدُمُ وَرُورُورُ مُرَدُمُ وَرُورُورُ مُرَدُمُ وَمُرَدُورُ مُرَدُمُ وَرُورُورُ مُورُورُورُ وَالْمُورُورُورُ وَالْمُورُورُورُ وَالْمُورُورُورُ وَالْمُورُورُورُ وَالْمُورُورُورُ وَالْمُورُورُورُ وَالْمُورُورُورُ وَالْمُورُورُورُ وَالْمُورُورُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ والْمُورُورُورُ والْمُورُورُ والْمُورُورُ والْمُورُورُورُ والْمُورُورُ والْمُو

- 31.2 ﻣَﺮْﺗَــْوَهُوْ وَجُرِدُوْ وَكُورُوْ وَرَاءَوْهُوْ وَرَّدُوْهُوْ وَمُرِيرٌ ﴿ وَمُرَدِّرُ وَ وَرُدُوهُو ﴿ وَوَرُورُ وَكُورُ مَا مُعْرِمُونُ هُوْوَدُ وَرَاءَهُوْ مِنْ وَرَدُوْهُوْ وَجُودُوهُوْ مُعْرَفُونَ مَا مَعْرِمَوْمَ

- 31.3 كَرْدُوْمْ دُوْ وَرْدَرْمْ وَ وَ كُرْدِوْرْ وَ الْمَرْدُورْ وَ وَرْدِيْرْ وَ وَرْدِيْرْ وَوَرْدَوْرْ وَرَوْرْ وَرَدْوْرْ وَرَدُورْ وَرَدُورُ وَرُورُ وَرَدُورُ وَرُورُورُ وَرُورُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرُورُ وَرُورُ وَرُورُورُ وَرُورُورُ وَرُورُ وَرُ
- 31.4 كَرْدُوْهُ وَ وَرِدُرَهُ وَ وَ وَرَدُوْهُ وَ وَرَدُوْهُ وَ وَرَدِيْ وَ وَرَدِيْ وَ وَرَدُوْهُ وَوَرُوْرُ وَ وَرَدُوْرُ وَرَدُورُ وَرُورُ وَرَدُورُ وَرُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرُورُ وَالْرُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُرَادُورُ وَالْمُورُورُ وَالْمُرْدُورُ وَالْمُرْدُورُ وَالْمُرْدُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُرْدُورُ وَالْمُرْدُورُ وَالْمُرْدُورُ وَالْمُرْدُورُ وَالْمُرْدُورُ وَالْمُرْدُورُ وَالْمُرْدُورُ وَالْمُرْدُورُ وَالْمُرْدُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُرُورُ وَالْمُرْدُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُورُ
- 32.1 32.1 36.6

3 - 22 25

- 33.2 "وَسَهُ رَمُ وَ وَ وَ وَكُرُو الْ رَوْرُ وَمَرَ وَمَرْ اللهِ وَسَهُ اللهِ مَا مَوْرِ اللهِ مِ وَمُوْرُ اللهِ مِ وَمُورُ اللهِ مِنْ وَمُورُ اللهِ مُورُورُ اللهِ مِنْ وَمُورُ اللهِ مِنْ وَمُورُ اللهِ مِنْ وَمُورُ اللهِ وَمُؤْمِرُ وَاللّهُ وَمُورُ اللّهُ وَمُورُ اللّهُ وَمُورُ اللّهُ وَمُؤْمِرُ اللّهُ وَمُورُ اللّهُ مُورُورُ اللّهُ وَمُورُورُ اللّهُ وَمُؤْمِرُ وَاللّهُ وَمُورُورُ اللّهُ وَمُورُورُ اللّهُ وَمُورُورُ اللّهُ وَمُورُورُ اللّهُ وَمُورُورُ اللّهُ وَاللّهُ وَمُورُورُ اللّهُ وَاللّهُ وَاللّهُ وَاللّهُ وَمُورُورُ اللّهُ وَاللّهُ ولِي اللّهُ وَاللّهُ ول
- 33.3 " وَسَهُ رَدَهُ" دُورُ فَسْرُورِ رُوسِ فِيوسْ مَعْ فَدِر فَكُسْ مَا رُورُ فَا يَرْوَهُ مِرْوَهُ وَسَهُ رَدَوُهُ
- 33.4 "وَسَهُرُمُونُ دُوْدُ فَسْ وَرِدُوسِ دُرَفُ فَوْدُ دُرُوسُ وَقَرْ دُرُوسُ وَ مَرْدُوسُ وَمِرَوَلَا وَسُرَ وَسَهُرُمُونُ وَمُرْدُونُ وَمُرْدُ وَرُدُنُ وَرَسُا وَرَسُا وَرَسُا وَرَسُا وَرَسُا وَرَسُا وَرَسُا وَرَسُا وَر
- 33.5 "دُرهُ سُوْرِ" بَرُر هُرَوْر دُوس، وَسَرَدَنَ وَبِرَوْرَهُ، وَسَرَدَنَ دُورِ وَكُرُورُ رَوْرُورُ وَكُرُورُ وَيُرَّهُ وَوْرِ وَسَرَدَاهُ وَدَوْرُورُ وَسَرَدَاهُ وَدَوْرُ وَرَدُونَ وَقَرْدُورُ وَوَ دَرَهُ سُؤُورُدُو.
- 34. وِهُرِيهُمْ 34.1. وِهُرُهُ الْمُؤْدُورُ الْمُؤْدُورُ وَهُرُهُ الْمُؤْدُرُهِ وَهُرُهُ الْمُؤَدِّمُ وَهُرُهُ وَالْمُؤَدِّمُ وَهُرُهُ وَالْمُؤَدِّمُ وَهُرُهُ وَالْمُؤْدُورُ ولِلْمُؤْدُورُ وَالْمُؤْدُورُ وَالْمُورُونُ وَالْمُؤْدُو

32. وَرُسُورُ مُورُدُ

プログラウン 0176

אפה עכשהת

2 2 6 1 3 מעמע

- 34.2 ﴿ ﴿ ﴿ وَ كُنْ وَ كُنْ وَ ﴿ وَ هُو وَ الْمُ الْمُ كَالَمُ مُو الْمُ الْمُ وَالْمُ الْمُ وَالْمُ وَ الْمُ وَ الْمُ عَلَى الْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُوالِّوُ وَالْمُ وَالْمُوالِّوُ وَالْمُوالِّوِ وَالْمُوالِّوِ وَالْمُوالِّوِ وَالْمُوالِّوِ وَالْمُوالِّوِ وَالْمُوالِّوِ وَالْمُوالِّوِ وَالْمُوالِّوْلِيَّالِيَّالِيَّالِيَّالِيِّ وَالْمُوالِّوْلِيَّالِيَّالِيَالِيَّالِيِّ وَالْمُوالِّوْلِيَّالِيَّالِيَّالِيَّالِيَّالِيَّالِيَّالِيِّ وَالْمُوالْمُولِيِّ وَالْمُوالْمُولِيِّ وَالْمُوالْمُولِيِّ وَالْمُولِيِّ وَالْمُولِيِّ وَالْمُولِيِّ وَالْمُولِيِّ وَلَا مُولِيَّ وَالْمُولِيِّ وَالْمُولِيِّ وَلَا مُولِيَّالِيِّ وَلَا مُولِيْلِيِّ وَلِمُولِيَّ وَالْمُولِيِّ وَالْمُولِيِّ وَلَالْمُولِيِّ وَالْمُولِيِّ وَلِمُولِيَّ وَالْمُولِيِّ وَلِمُولِيْلِيِّ وَلِمُولِيْلِيِّ وَلِمُولِيْلِيِّ وَلِمُولِيَّ وَلِمُولِيْلِي وَلِمُولِيْلِيِّ وَلِمُولِيْلِي وَلِمُولِيْلِي وَلِمُولِيْلِيلِيْلِي وَلِمُولِي وَالْمُولِي وَلِمُولِي وَلْمُولِي وَلِمُولِي وَلِمِلْمُولِي وَلِمُولِي وَلِمُولِي وَلِمُولِيَالِمُولِي وَلِمُولِي وَلِمُولِي وَلِمِلْمُولِي وَلِمُولِي وَلِمِلْمُولِي وَلِمُولِي و
- 34.3 و دره مَ مُوْوَدُ دُرِهُ الْمُؤْمِدُ مُوْرُوْمُ مُرَوَّ مُرَمِّ مُعْرَسُوهُ مُ مُوَرُّوْمُ مُرَّهُ وَمُرْمُو مُرَوْمُ مُرَامُ وَمُرَمُونُ وَمُرَمُونُ وَمُرَمُونُ وَمُرَمُونُ وَمُرَمُونُ وَمُرَمُونُ وَمُرَمُونُ وَمُرَمُونُ وَمُرَمُونُ وَمُرْمُونُ وَمُونُونُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَمُونُونُ وَمُرْمُونُ وَمُرَامُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَالْمُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُؤْمِونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَالْمُونُونُ وَالْمُونُ ولِمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ ولِمُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالِمُ وَالْمُونُ و
- رَوْرْمَيْرُسُ 35.2 رَوْدُورُمِرُ رَمْرُورُمُورُ وَمَدُورُمِرُ رَمْرُورُمُورُ وَمَرَدُورُمِرُ مَا مُؤْدُورُمِر وَسَهُمَامُ بُرُورُورُورُمِرُ وَمُدُمُ الْحَوْدُورُورُ وَمُدَمُ الْحَدُورُمِ وَمُدَوْرُمِرُ عِسْرُدُورُرُمُ وَسُمْرُو.
- دُهُوَمُ وَ مَهُمُ مُرَّالُهُ مُرَّالُهُ مُرَّالُهُ مُرَّالُهُ مُرَّالُهُ مُرَّالُهُ مُرَّالُهُ مُرَّالُهُ مُر وَسِرُوسُهُ مِرْسُرُهُ وَيُعْرَدُ لَهُ مُرَالُهُ مِرْدُورُ وَهُورُ مِرْدُ لَهُ مُرَالُهُ مُرَالُولُ مُرَالُولُ مُرَالُهُ مُرَالُهُ مُرَالُهُ مُرَالُهُ مُرَالُولُ مُرَالُولُ مُرالُولُ مُرَالُهُ مُرَالُولُ مُرَالُولُ مُرَالُولُ مُرَالُولُ مُرالُكُمُ مُرالُولُ مُرالُكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالُكُمُ مُرالُكُمُ مُرالُكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالُكُمُ مُرالِكُ مُرالِكُمُ مُرالُكُمُ مُرالُكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالُكُمُ مُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُمُ مُرالِكُمُ
- 37. هَهِ وَسُرِّمَ يَهُ وَ هُرَ مُرَهُ وَهُ وَهُرَهُ مُرْهُ وَالْمُرَاهُ وَهُرَوْهُ وَهُرَوْهُ وَالْمُرَاهُ وَسُرَاءُ وَهُرَالُوهُ وَهُرُوهُ وَهُرَامُ وَهُرَاءُ وَسُرَّا وَهُرَامُ وَهُمُ وَمُرَامُونُ وَالْمُرَامُ وَمُرَامُ وَهُرَامُ وَهُرَامُ وَهُمُ وَالْمُؤْمُ وَالْمُوالِمُ وَالْمُؤْمُ وَالْمُوالُومُ وَالْمُوالُومُ وَالْمُوالُومُ وَالْمُوالُومُ وَالْمُوالُومُ وَالْمُوالُومُ وَالْمُوالُومُ وَالْمُلِمُ وَالْمُوالُومُ وَالْمُوالُومُ وَالْمُؤْمُ وَالْمُوالُومُ وَلِمُ وَالْمُوالُومُ وَالْمُؤْمُ وَالْمُؤْمُ وَالْمُوالُومُ وَالْمُؤْمُ وَالْمُؤْمُ وَالْمُؤْمُ وَالْمُؤْمُ وَالْمُؤْمُ وَالْمُوالُومُ وَالْمُوالُومُ وَالْمُوالُومُ وَالْمُوالُومُ وَالْمُؤْمُ ول
- 37.2 الحَوْرُ اللهُ 2,500,000 الْمُرَوْمُ مُرَدُهُ اللهُ ال

CP*0.005*LD = مُورِّدُ وَيُورُّدُ وَالْحَاثُونُ عَلَيْهِ عَلَيْهِ عَلَيْهِ عَلَيْهِ عَلَيْهِ عَلَيْهِ عَلَيْهِ

CP (سرع سع فر برد و): سرع برسع کی فرو کرد

D (مُعْ يِرْمُرُونُمْ رَمُونُهُ مُونُ لَا مُعْرَفُهُمْ وَمُوْفِمُ رَمُونُو مُونُونُمُ مُرَوْمُمُونُ مُرُوسُونُ

- 37.3 وَسَادُمَاهُ سَرْسِرِ وَسَاقُ وَدَوَهُ وَسَادُمَاهُ رَقَوْهِ وَنَكُوهُ وَرَجُهُ وَرَسَا وَرَسَا وَرَسَاهِ وَسَادُوهُ وَسَادُهُ وَرَسَادُهُ وَرَسَادُهُ وَرَسَادُ وَسَادُهُ وَرَسَادُهُ وَرَسَادُ وَرَسَادُ وَرَسَادُهُ وَرَسَادُ وَرَسُودُ وَسُودُ وَرَسُودُ وَرَسُودُ وَرَسُودُ وَسُودُ وَرَسُودُ وَسُودُ وَرَسُودُ وَرَسُودُ وَسُودُ وَرَسُودُ وَسُودُ وَسُودُ وَسُودُ وَسُودُ وَرَسُودُ وَسُودُ وَسُو
- 37.4 وَسَمُرُمُوهُ فَوْرُ رُدُو لَى 15% مِيرَّسَارُهُ مُرَوْمُ بِرِنْدِيْعَ الْحَصْرُ هَا وَلَا مِيرَّهُ مَا مُرَوْمُ بِرِنْدِيْعَ الْحَصْرُو فَالْمُو مُنْ مُرْوَمُ بِرِنْدِيْعَ الْحَصْرُو اللَّهِ اللَّهُ اللَّ

- 39. مُرْسِرْش 39.1 دِرُدُهُ الْمُوْدُورِ مُرَوَّمُونُ الْمِرْدُورُورُ الْمُرْسُورُ دُرُونُ وَلَا اللهِ عَلَيْ وَمُورُورُ اللهُ وَلَا اللهُ الله
- 40. غات رَخِر (40.1 و وَسَهُ رَمُ مُرَّمَ اللَّهِ الْمُعَامِّةِ الْمُعَامِّةِ الْمُعَامِّةِ اللَّهِ مُرَّمَّةِ اللَّهِ مُرَّمَّةً اللَّهِ اللَّهِ مُرَّمَّةً اللَّهِ وَسَهُ اللَّهِ وَسَهُ اللَّهِ وَسَهُ اللَّهِ وَسَهُ اللَّهِ وَسَهُ اللَّهِ وَسَهُ اللَّهِ وَاللَّهُ اللَّهُ الللْمُعُلِمُ اللَّهُ اللْمُعُلِمُ الللْمُعُلِمُ اللْمُعُلِمُ اللْمُعُلِمُ الللْمُعُلِمُ ال
- 41. ئەرە ئىرۇرى كىلىدى ئىلىرى ئىلىرى
- 42. دره مُصُوْوَدُرُ 42.1. وِدَرهُ صُوْسُ رِسُرَيْسٍ، دَرِ هُسُرِ وِثْرَيْرَ مِيْ رَوْرِيَّدُوْءَ ؛ تُنْرَسْرُهُ بَارِ ذَوْ وَمُنَّارٍ دَرْدُهُ هُرُوْ. وَمُنْ وَرَوْرِيَّارٍ دَرْدُهُ هُرُوْ. وَمُنْ وَرَوْمِ مُنْ وَرَوْمِ مُنْ وَرَوْمِ مُنْ وَرَوْمِ مُنْ وَرَوْمِ مُنْ وَرَوْمِ مُنْ وَرَوْمُ مُنْ وَمُؤْوِدُونُ مُنْ وَرَوْمُ وَمُنْ وَرَوْمُ مُنْ وَمُؤْمِونُ وَمُنْ وَمُؤْمِونُ وَمُنْ وَمُؤْمِونُ وَمُنْ وَمُؤْمِونُ وَمُنْ وَمُؤْمِونُ وَمُنْ وَمُؤْمِونُ وَمُوالِمُ وَمُعُومُ وَمُوالِمُ وَمُوالِمُ وَمُوالِمُ وَمُنْ وَمُوالِمُونُ وَلَمُ وَالْمُوالِمُ وَالْمُولِمُ وَالْمُوالِمُ وَالْمُوالِمُ وَالْمُوالِمُ وَالْمُوالِمُ والْمُوالِمُ وَالْمُوالِمُ وَالْمُولِمُ وَالْمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالْمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُ والْمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُ وَالْمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوالِمُوال
- 43.2 دِرُرُهُ الْوَدُورُ الْرُورُورُورُ عِرَوْرُورُورُ الْمُرْدُ الْمُدُورُ الْمُرْدُورُ الْمُو

פלים לירול לאפים לירול ביל לא ליים אל היים אל היים של היים של היים מים היים של היים אל היים אל היים של היים של

| לינ' ל' | # |
|---|--------------------|
| יל ל האל האל ל הרוב ל האל ל הרוב ל האל האל האל האל האל האל האל האל האל ה | 13 0 j 0
10 j 0 |
| ره (در رو و و و و و و و و و و و و و و و و و | 9 1 |
| سروسرائو عسر سرور المرابع و مسرم المردم و تردون و الرئير و مرتبر و مر | 2 |
| ىزرى ئېرى د ئېرۇرى (خ ئىرۇنو 3) | 3 |
| رسوع بري سوه بر شور سور ره بر (ي. رسور ور بري سوه برسر وروسرد) | بٍ 4 |
| לָכֹצִת הְעִעָּכָנ נְמִלְ לָנִתְּעִ (צָפִּאִתְנָתִשֶּׁאִתְּ) (שִׁבְּפָּלְ 7) | |
| 6. פֿית ברבנצת ברנית את ברנים אינים | |
| (مربرع (مربرع (مربراروی (مربراروی (مربراروی (مربراروی (مربراروی (مربراروی (مربراروی (مربراروی (مربراروی (مربرا | |
| יני ב אור ביני ביני ביני ביני ביני ביני ביני בינ | <u> </u> |
| وَسُ رَبَرَةً وَسَهُ رَمَا مُذَوْدُهِ وَسَهُ رَمَا هُوَ مُعْ مِعْ وَ وِهُ سُوهُ اللَّهِ عَامُووُ وَ | @ |
| カラダンファ ウンファダ
カラダンファ アンファダ | , |
| ر درور (صرب کنرس هار بردع و و و و و کر) که و اور می که در که در که در که در کرد برد کار در | 9 |
| ייי פאר אר א | ر
موسر ر- |
| נננסנ סווי איז פר | |
| ירים) או רפים ריסים ליסים ליס | _ |
| יפר תיתם ג בל בות (מבל הפנג בל תמת מבל פת הפנגעת התצבפת) | |
| מו מו איני איני איני איני איני איני איני אינ | |
| יני ג'יס נ' נ'יטיס ה' 0000 מיס אלייטיס אייס אייס אייס אייס אייס אייס אייס | 13 |
| בין אר ביני בין בין בין בין בין בין בין בין בין בי | |
| ל ב פרים התקלת ב אפתה הפתפת בעל שטרים עק האתרים אקפו ב עון (בנע אפרת הפתפת בעל שטרים עק האתרים אקפו ב עון (בנע אפרת הפתפת ברים ברים ברים ברים ברים ברים ברים ברים | 14 |
| פר ב מי מי מי ב מי ב מי ב מי ב מי ב מי ב | 1 15 |
| وُرِي تُوسِ مُوسُورُ سُرُومُ وَرُو مُرْسُرُ مُرْدِرُ مُرْدُ وَرُدُو مِرْسُرُ) (دُرْنَا بِرُوْرُسُ 3 وَسُو رُوسُورُ) | خ ا |

| ئے قرف ر | |
|----------------------------|--|
| 00 4113 01
23 5121 29 0 | |

| | | 2 12 22 2
12 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 | 6347 1113 0
5843 5141 M | 1. مِرَ |
|--|--|---|--|------------------------|
| | | | ىتركىثر | 1.1 |
| | | | ۵ ۵ ۵ ۵
ارځ برسو | 1.2 |
| | | 2422 (
52412 (| 00 C C 0 11 1 2 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 | <i>•</i> • • 2 |
| | יים ביים אים אים
יים בקל ביים האים
יים בקל ביים האים האים האים האים האים האים האים ה | 13 0 1 37 7 7 3 7 5 9 7 5 7 | 0 × 00 0 × 0
אַ אַבַּיַ עשַ 2 יינייק
אָרָבַ עשַ 2 יינייק | 2.1 |
| | C-3 | 381/I-2022/23 | ת הקלית יתיתם ה | 2.2 |
| | | | 3603 150 51. | 3. زیز |
| | | | 3/ 1//3 | 3.1 |
| | | | يح . رُسم . ج | |
| | | | 3/ /03
3/ 42 | |
| | | ر ورور () | فَحْرُ رُدُدُ (هُسَرَرِ " | 3.2 |
| | | مورد روسرريس | ره در در (۵ میر تر تر کو ^د | 3.3 |
| | | 2 % 0
2 % X
7 S X | 6341 4113 0
5843 5171 M | .4 o |
| 01101 01101
24500 2000 | 000,00 (1422),1 ,002 0x20
5872750 (162712 9135 72777753 | وُ وُسَوْرُهُمُ الرِوْرُومُ | י י י י י י י י י י י י י י י י י י י | |
| | عَرْوَهُ وَرُهُ وَمِيدًا وَسُرِيرُو وَرُولُ الْرَوْدُ وَسُورُكُ بِرُونُ وَرُولُ وَرُولُ الْرَوْدُ الْرُولُولُ الْرَوْدُ الْرُولُولُ الْرَوْدُ الْرُولُولُ الْرُولُولُولُولُولُولُولُولُولُولُولُولُولُ | | 4.1 | |
| · | | | .935/27 | |
| | ב אם מבים כם מוכבתם המתכת בתכ" מי
הפכם בממת המת תפקממי מיים | ¿¿٥٠٠, ٤٠٠, ٤٠٠, ٤٠٠, ٤٠٠, ٤٠٠, ٤٠٠, ٤٠٠, | رُوْدُس الرُودُس | |
| - | | | | 4.2 |
| | 0/22// 0/X01 // 0X20/ 0/
0/2/// 0/X01 // 0X20/ 0/
0/2/// 0/20/ 0 | 0 6 0 / / 0 / 2 20 | | |
| ارْزُوْسِ اللهِ المِلْمُ المِلْمُ اللهِ اللهِ اللهِ اللهِ اللهِ اللهِ اللهِ اللهِي المِلْمُ المِلْمُ اللهِ اللهِ اللهِ اللهِ المِلْمُلِي المِلْمُ اللهِ اللهِ اللهِ المِلْمُلِيِّ اللهِ اللهِ المِلْمُلِي المِلْمُ | | ان بحروسه رو وسربرس | ر و و و کر ر کر کر کر گر | |
| | | | | 4.3 |
| | | 01103 (110
00000 (2000) | ,00 003 /3/
010 003 /3/
010 003 003 /3/ | 4.3 |
| | מאל מל | 01103 (110
00000 (2000) | ,00 0 0 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 | |
| | מאל מל | 01103 (110
00000 (2000) | ,00 003 /3/
010 003 /3/
010 003 003 /3/ | ź∞ ·5 |
| (בקפיאת בינקפינדי) | מאל מל | 01103 (110
00000 (2000) | ,00 0 0 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 | <i>≨•</i> .5 |
| | מאל מל | 01103 (110
00000 (2000) | ,00 0 0 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 | , .5 |
| (و و و و رو ر | מאל מל | 01103 (110
00000 (2000) | ,00 0 0 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 | 5. چې 5.
پېر
ښور |

| ן. דירו היוני הרפידים
1. דירוע פאפט בחפרים | 1. בריו ביור המונים
1. בריוע באפש בהפלפים | | | |
|---|--|---|------|----|
| | | . יוכ) ירכניי
ל דעמב בהדבים
ל האמב בהדבים | 1153 | ·1 |

| | سرَيْنْ | -1.1 |
|---|--|------|
| | بري سوه بر در | -1.2 |
| | 0 (0 (1/9) 9 () 1 () | -1.3 |
| | 2 00 00 x 2 00 00 x 2 00 00 x 2 00 00 00 x 2 00 00 00 00 00 00 00 00 00 00 00 00 0 | -1.4 |
| | ۵۰۰ مرکز از کار | -1.5 |
| | בן . אנר ש שיני ייניינייל איני
איני אנר ש שיני ייניינייל איני | -1.6 |
| | ין ב' יו ס' ב'
ד' ער עיקיס' מ | -1.7 |
| | 0 (0 (0 (
- x & n - y n z n / n z n / n z n / n z n / n z n / n z n / n z n / n z n / n z n z | -1.8 |
| נס אר מינים ארנונים ארנונים אינים ארנונים ארנונים ארנונים ארנונים אינים ארנונים אינים ארנונים אינים ארנונים ארנונים אינים ארנונים אינים ארנונים אינים ארנונים אינים ארנונים אינים ארנונים אינים ארנונים ארנים ארנ | (0000) (000) (0000) (0000) (0000) (0000) (0000) (0000) (0000) (0000) (0000) (0000) (0000) (0000) (0000) (0000) | .2 |
| | בר בר בי אל בא | • |
| 2 % 7
2 3 2 | מק'יל | # |
| 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 | | |
| , o c
x ev x z | | |
| , o c
×ev× t | | |
| | | |
| | 0/0/0/ / 1/0×201
1880470-19 19 19 19 19 19 19 19 19 19 19 19 19 1 | .3 |
| | | |
| | | |
| | | |
| | | |
| | | |
| | | |
| | | |
| | | |
| | | |
| | | |

| | | | | 2 422 :
5 2 4 1. | 0) (0)000)((04) 4)/0
10 SVSEMAVA SSKJ Y/V/ | ه توسر |
|--|----------------|---------------------------|---|---------------------|---|--------|
| נפ דרב מפתח
נפ דרב מפתח
נפיר הצבולות | - | 014 (0037 (
090 S RAVA | | | מינים מינים
מממש ממששא | # |
| | | | | | | |
| | 5. | 0 7
2 E | | | יייי ג'יייי (יייייי (ייייייי (יייייייייי | 0 40 |
| ﴿ رُوْرٍ بَرُوْرُورٍ مِرُورُورٍ (رُورُورٍ مِرُورُورٍ (رُورُورُورُورُورُورُورُورُورُورُورُورُور | 2/03
5/2/2/ | 2 2 C 2 22
2 C V X Q M | 0 % 7 7 7 7 8 4 8 4 8 8 8 8 8 8 8 8 8 8 8 8 | 222
4 Y | למת בתפסמב בהתבה
ני 0 כני
מתוש במת בתסב יינית | # |
| | | | | | | |
| _ | / 0 2
/ 2 E | | | | | |

ئَى تُوْفَوْ - 5 تُرِمْدِهِ 3 (مِسْرُدُ) دَرَيْرَیْ مُسْکَارِ سَرْکَرِدِ وَ مَدْرَبْرِ وَسَادُرَاهُمُورُ

| | | 0 0/ 62/0/0/1/
10 50 50 50 50 50 50 50 50 50 50 50 50 50 | 2022 # 10× (2#1 #112
*155 | ه نوشر |
|---------------------------------|-------------------------------|---|---------------------------------------|--------|
| دُسور کرد کرد
(درور کروردسر) | 20101
201012
211
211 | 0 / 1 (2 / 0 / 1 / 0 / 0 / 0 / 0 / 0 / 0 / 0 / 0 | י י י י י י י י י י י י י י י י י י י | # |
| | | | | |
| | | | | |
| | | | | |
| | :5° è | | <u> </u> | |

مع: رور مسرر سروس (رزارد) 25 رسامه روو وسروره ورود و مردوره

| 200 ×
3 | * 00 אאן אירן 20 0
דָרְיִינִש בֿקפִיינ בּסִב סִּדְּרִייְּיַפְּ | ה תמש בקפת
בקרת
בקרת |
|------------|--|-----------------------------|
| 70 | לתלע השל לד הצל לתלע הצ × 70 (הצ על ב פאמת בש ברשת ב ב ברשת בש ברשת ב ב ברשת ב ברש | 3 /
3 / |
| 20 | לתל המל לה לל לה לל לה לל לה לל אינה אינה אינה בר לה לל | ۰ ۵ ۰ ۵
و ۵ ترمی |
| 05 | ﴿ رُرَّهِ ﴿ وَ يَحْفَىٰ هُا مِرْدَدِ مُسْرَدُ مِسْ ﴿ فِحْفَاهُ هُمَا اللَّهُ لَا كُوفِهُ ﴿ 05 ﴿ 50 ﴿ وَمُرْدِدِ وَمُعْلَمُ الْمُعْلَمُ وَمُنْدٍ ﴾ (قَيْ يَرِدُ لَا يُعْرِدُ وَمُعْلَمُ وَمُنْدٍ وَمُنْدٍ) | (|
| 05 | رَرَرَءِ وَجِرَدُ / رَرَرَءِ رُسُرَوَ وَجِ وَجِرَدُ \times 05 \times 05 \times 05 \times 05 \times 06 \times 20% \times 2 | ر
در قورنسر
در قورنسر |
| 100 | | 103 |

7 - مَحْرُورُ (مرام المُحْرِي مُرَاثِينَ (مرام المُحْرِينَ مُحْرِينَ مُعْرِينَ مُعْرِينَ مُعْرِينَ مُعْرِينَ مُعْرِينَ مُعْرِينَ مُعْرِينَ مُعْرِينَ م

| | | | С | | | |
|--|----------------------------------|----------------|--|--|---|--|
| | | | | | | |
| | | | | | | |
| رم
مرم | " " " " " " " " " " " " " " " " | | מר מ | מ ממב מ ב כ ב ב
בקנת כת ע בק ע מיק כם מ | ייק קיינו | |
| | | | ٠ <i>٠ ٠ ٠ ٠</i>
برسرور و . | 2 23 25 25 | י כ 0
ק בקינת
1 | |
| 3),3,3
39,20 1,500 1,0
1,0 | / 0/206 11/23
11 150511 15079 | 23.5 3.5 19.5. | . تروّرو مرير. | נב מריים בים
דב מריית התיים | · 3 / 3
// £ V | |
| מנו ל אינו אינו אינו אינו אינו אינו אינו אינו | 50101 | 6336
524A | ינ <i>פ</i> ק ינ | وسوره | سوار تر بخ
م | و کے قرار |
| | <i>g</i> | 10× 3/2 | ? /w/g | | ••••• | ימלים איני |
| | | - | | 0 / / /) ،
برسرور و . | رسرر رُوُوْمِ مَرْ | ית מל אל |
| ٤ | رو رو | >> 0/0/
*V | / | 20%/ /: |) /
) + @ ? | |
| ברות הלבות בארים | | 3 0 | | | 7,7 | |
| | | / 0 0 C 0 0 X | 4 | | ,,,,,,, | |
| נית ביות (סית בק בקפרים הצת
נית ביות (סית בק | יינע פאילית ו | 15805800 | | | | |
| | | | تر <i>و ۱۷۰</i> ۶۰ | ? | 5 91557 5 17 | י (מתנגיות) |
| תפ בחמה משלע ברפת | 15/12 1524 n. | ورور و وروز | 2712 15 | ى رۈسرۇرۇ | 2402 | |
| 2022 | | | | | | برور مور م |
| | ((/))))/) /
·9/*V/#03 | | | | | |
| | | | ם מממ
יש הבקב פי | 00 | ון מ
מיג פיג | |
| | | | | | | |
| | | | | | | |
| (, <u>*</u>) | | | | | | |
| (3,) | | | | | | |
| | | | | | | |
| | | | | | | |
| (2000 2 2 2.00 A | Źź) | | | | | |
| | | | | در درور
در کارسرسو ر | / 1 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 | 2 × 1 |

ورد دردد / ورور بره مرور برور در ۱ مرو در برور برور برور

| С |
|---|
| |
| |
| |
| |
| رُون رُمْدُو وَرُسْرُهُ وَ رُدُونِ رُدُونُ مِرْدُ مُرْدُونُ مِرْدُ دُووُ وُسُووُ |
| |
| ·979775 7377 9 |
| مُعَارُورٌ مُرْسِ مِوْسٌ مِرْدُرُو مُعَرِدُرُ مُورِ وَمُرُورٌ مُرَدُ مُرَادِ وَمُرْدُ مُرْمُ مُرْدُونُ مُرْسِ |
| ר כ כ ה ה כ כ ה כ ה כ ה כ ה כ ה כ ה כ ה |
| |
| رُوْسَوْرُ وَدِيْ رُدُوْدُسِ فِي ﴿ مِنْ الْمِنْ وَسِرِي مِنْ اللَّهِ وَسِرِي مِنْ اللَّهِ وَمِنْ اللَّهِ وَمِنْ اللَّهِ وَمِنْ اللَّهِ وَمِنْ اللَّهِ وَمِنْ اللَّهِ وَمِنْ اللَّهِ مِنْ اللَّهُ مِنْ اللَّهِ مِنْ مِنْ اللَّهِ مِنْ مِنْ مِنْ مِنْ مِنْ اللَّهِ مِنْ اللَّهِينَامِ مِنْ مِنْ اللَّهِ مِنْ اللَّهِي مِنْ مِنْ مِنْ مِنْ اللَّهِ مِنْ مِنْ مِنْ مِنْ اللَّهِ مِنْ مِنْ مِنْ مِنْ مِنْ مِنْ مِنْ مِن |
| رُجِرُ بُرُدُ وَ مُرْوَ مُرْدُ مُر |
| در درع
رعربرو و |
| י ני קנדים בטינים .
מומצב בשת ממתבפית
מומצב בשת ממתבפית המפפי |
| 2022 |
| |
| |
| |
| |
| |
| |
| (200 2 2 2 2.11) |
| ים) האב ז כ כ כ ר הכנ הכם ם
תקינת המצי בקמינו של הפבן מהנינייין
ת |
| ۵ / د / رد
۷ غ / و و ر کر رد
۷ غ / و و ر کر رد |

| Form of Performance Bank Guarantee (Unconditional) |
|--|
| To: |
| |
| WHEREAS |
| AND WHEREAS it has been stipulated by you in the said Contract that the Supplier shall furnish you with a Bank Guarantee by a recognized bank for the sum specified therein as security for compliance with his obligations in accordance with the Contract; |
| AND WHEREAS we have agreed to give the Supplier such a Bank Guarantee; |
| Now therefore we hereby affirm that we are the Guarantor and responsible to you, on behalf of the Supplier, up to a total of * |
| *An amount is to be inserted by the Guarantor, representing the percentage of the Contract Price specified in the Contract, in Maldivian Rufiyaa. |
| We hereby waive the necessity of your demanding the said debt from the Supplier before presenting us with the demand. |
| We further agree that no change or addition to or other modification of the terms of the Contract or of the Works to be performed there under or of any of the Contract documents which may be made between you and the Supplier shall in any way release us from any liability under this Guarantee, and we hereby waive notice of any such change, addition, or modification. |
| This Guarantee shall be valid until the date of issue of the Defects Correction Certificate. |
| SIGNATURE AND SEAL OF THE GUARANTOR |
| Name of Bank |
| Address |
| |
| |
| Date |
| ع <i>څرگو -</i> ع څرگو کا او |

0 ((00 / U 0 0 % 0 (EMP & EMP & N 9 EN

| To: | Form of Bank Guarantee for Advance Payment | | | | |
|------------------|---|--|--|--|--|
| | [name & address of Purchaser] | | | | |
| | [name of Contract] | | | | |
| Gentle | men: | | | | |
| | ordance with the provisions of the Conditions of Contract, of the above-mentioned ct, | | | | |
| | address of Supplier] (hereinafter called "the Supplier") shall deposit with | | | | |
| Purcha
Clause | [name of aser] a Bank Guarantee to guarantee his proper and faithful performance under the said of the Contract in an amount of[amount of Guarantee] | | | | |
| [Bank irrevoc | or Financial Institution], as instructed by the Supplier, agree unconditionally and eably to guarantee as primary obligator and not as Surety merely, the payment to [name of Purchaser] on his first demand | | | | |
| | t whatsoever right of objection on our part and without his first claim to the Supplier, in ount not exceeding * | | | | |
| | ntee][amount in | | | | |
| or of V
made | ther agree that no change or addition to or other modification of the terms of the Contract Vorks to be performed there under or of any of the Contract documents which may be between | | | | |
| | aser] and the Supplier, shall in any way release us from any liability under this atee, and we hereby waive notice of any such change, addition, or modification. | | | | |
| * | An amount is to be inserted by the Bank or Financial Institution representing the nount of the Advance Payment, in Maldivian Rufiyaa. | | | | |
| | uarantee shall remain valid and in full effect from the date of the advance payment under ntract until | | | | |
| repaym | nent of the same amount from the Supplier. | | | | |
| | truly,
FURE AND SEAL: | | | | |
| | ים יים אם | | | | |

﴿ وَوَى عَبِي اللَّهِ مِبِي مِنْ لِهِ اللَّهِ عَبِي اللَّهِ عَبِي اللَّهِ اللَّهِ اللَّهِ اللَّهِ اللَّهِ اللّ ﴿ وَوَلَا وَمِنْ عَبِي كُلَّ فِي مَنْ اللَّهِ اللَّهِ عَلَيْهِ اللَّهِ اللَّهِ اللَّهِ اللَّهِ اللَّهِ اللَّه

رَدُرُورُ وَسَوْعِ وَوْ سِورَةٍ وَسَوْمِ الْرَوْدُ وَسَورَةُ وَسَورَةُ وَسَورَةُ وَسَورَةُ وَسَورَةُ وَسَورَةُ ﴿ رَدُرُورُ وَكُورُورُ الْرَدُورُ وَسَوْمَ وَاللَّهُ وَاللَّالِمُ وَاللَّهُ وَاللَّالِمُ وَاللَّهُ وَاللَّهُ وَاللَّهُ وَاللَّهُ وَاللَّهُ وَاللّ ** وَاللَّهُ وَاللّ

> הים ה'ינת - 6 הים הים היבינת הרים היפינת תוכנת

| | ای سرسر تو گره!") گرد | ر <i>چ</i> ی تورسر " | (339 6227) | . وُسر، | 1 2 2 2 2 2 2 2 2 1 2 1 2 1 2 1 2 1 2 1 | 0 C
5 A P | |
|-----|-----------------------|----------------------|-------------------------------|-------------------------|---|--------------|--|
| 5/5 | | פ'י <i>ילרו א</i> | و پر _{تو} سهسره هیر، | ولا تركزه ") الدورور ور | ر و کورسر "و | (330-6017) | |
| | | | | | د ر د ، ، ،
قرو <i>ر ار و</i> . | () | |

وُرِدُورُ الْرَسَادُ مَا وَرُدُورُ الْرَسَانِ الْرَدُورُ وَ وَرُدُو الْرَسَادُ مَا هُورُورُ الْرَسَانِ مَا هُورُورُ وَالْرَسَانِ مَا هُورُورُ وَالْرَسَانِ مَا هُورُورُ وَالْرَسَانِ مَا وَالْمَالُورُ وَالْمَا وَالْمُورُ وَالْمُؤْرُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُؤْرُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَلَامُورُ وَالْمُؤْرُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَلَامُؤُرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُودُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُؤْرُودُ وَالْمُودُودُ وَالْمُؤْرُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ

ر ۵٬۵۰۱ د ۱۵٬۵۰۱ د ۱۵٬۵۰ د ۱۵٬۵۰۱ د ۱۵٬۵۰ د ۱۵٬۵

| ر ((2)) | |
|----------------------------|---|
| :هُر | :,> <u>*</u> |
| سَرَيْر: | سَرَيْر: |
|
5 گرگر:
6 کرد کرد : | : 2 3 3 |
| ; 201
: 2m3nso | ; 30° 200 2 5 5 6 5 6 6 6 6 6 6 6 6 6 6 6 6 6 6 6 |
| رُرسِر: | رُرِيرُ: |
| رُمِيْر:
* در: | :م
سور: |
| · | |

| سَرَسُو: | . سريس: |
|---|--|
| : 53.6: | : 232 |
| :#±·n´n | :#2.77 |
| ר יוני האר יארט יון די | ליים אל אלים מיל לי בילית
ליים ממשל ביל אלים אלים אלים אלים אלים אלים אלים אל |
| :^* | :برد: |
| سرَسيْر: | سَرَيْر: |
| : 6 | : 5 % 5 |
| :#±·n´n | :#5:27 |
| (2) , 0 , (2)
(2) , 0 , (3)
(2) , 0 , 0 , (4)
(4) , 0 , 0 , (4)
(5) , 0 , 0 , (4)
(6) , 0 , 0 , (4)
(7) , 0 , (4)
(7)
(7) , 0 , (4)
(7)
(7) , 0 , (4)
(7)
(7)
(7)
(7)
(7)
(7)
(7)
(7 | |
| : - × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × | : " × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × |

0/11/ 3×150 -

1- وسور مرفود مؤرسور

- 1.1 כשיעם מפת יוניניין ביוני נוצר מציים יים ביוסיים ביוני
- 1.2 سُرُورِسُ رَءَسُوعُ مُنْ مُعْرَدُ مُعَادِمِسُ (سَرَّدُوْنِيَّ مَامِ '70×'50 ثُرُعُ ، رَعِرِ وِرْيَّمُوَيْ كَامِ 8.2× 8.3 ثُرُعُ) دُوْ.
- 1.4 שَـُوْهُوْ وَمِـ مُنْهُمْ مِرْ وَجُوْهُ وَدِ هُـ هُمْ مُنْهُ عَ يُمَاسُونُ دَوِ دُعْ يُرِمِ دُهُ وَسُرَدِيْ مُرْهُ مِرْدُهُ وَمُرَدِّ مُرَدُ مُرَدُو دَجِ بِدَوْدَدُدُ كَا مُرْجِ عَايُمَارُ وَسُرُوْمُونَا وَدَ
- 1.5 دُوْ سُرُولِسُ دُمِ وَضَمِوْدُ دُوْدُوْ دُمَاسُ وَسُرْعَ مُدُودُ دُولِوَدُدُودُ سُرُولُوسُ وَسُرَّمُ وَسُرَّمُ دُمُ مَارُكُونُ دُمُ مُرَدُو دُمُولُونُ مُرَوْ دُمُولُونُ دُمُ وَسُرْعُ مُؤْدُ اللّهِ وَسُرَّعُ مُرَوْدُ اللّهُ مِرْدُولُونُ اللّهِ وَسُرْعُ مُرَوْدُ اللّهُ مِرْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مُرْدُولُونُ اللّهُ مُرْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْ اللّهُ مُنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مُولُونُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مُنْدُولُونُ اللّهُ مُذَالِقُونُ اللّهُ مُولُونُ اللّهُ مُولُونُ اللّهُ مُنْدُولُونُ اللّهُ مُولُونُ اللّهُ مُنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مُنْدُولُونُ اللّهُ مِنْدُولُونُ اللّهُ مُنْدُولُونُ لَا لَا مُنْدُولُونُ لَا مُعْلِمُ مُنْدُولُونُ اللّهُ مُنْدُولُونُ لَا مُعْلِمُ مُنْدُولُونُ لَا مُعْلِمُ مُنْدُولُونُ مُنْدُونُ لَا مُعْلِمُ مُنْدُولُونُ مُنْدُونُونُ وَلِمُ مُنْدُولُونُ ولَاللّهُ مُنْدُونُ مُنْدُونُ لَاللّهُ مُعْلِمُ مُنْدُونُ لَا مُعْلِمُ مُولِمُ مُنْدُونُ لَاللّهُ مُنْدُونُ لَاللّهُ مُنْدُونُ لَا مُعْلِمُ مُنْدُونُ لَاللّهُ مُنْ مُنْدُونُ لَا مُعْلِمُ مُولِمُ مُنْدُونُ لَا لَاللّهُ مُنْ مُنْ مُنْ مُولِمُ مُنْدُولُونُ لَاللّهُ مُنْ مُنْ مُنْ مُنْ مُنْذُولُونُ لَاللّهُ مُنْ مُنْ مُنْ مُنْ مُنْ مُنْ مُنْ مُولِمُ مُنْ مُولُونُ لَا مُعْلِمُ مُنْ مُنْ مُولِمُ مُنْ مُولِمُ مُولِمُ مُولُولُونُ لَا م
 - 1.6 سرو وسرى صحير 4mm كىرۇنىس قىسرۇكىس سرۇسردۇ.
 - 1.7 دشرقر ساق (تردُورِ دُوَرُ دُورُ دُسُورُ لَا فَي عَلَيْ اللهِ وَكُلُودُ عِلَى اللهِ وَلَمْ وَاللهُ اللهِ اللهُ اللهُ

- 4" 1.10 1.
- 1·10 سَرُوكِرُ رَخُ سِرِدُوَدُورُ رَخِوَم وَخُورُ 1 مِرْمِ 2 مِسْمِهُ وَنَاءَ كَانَارُ مُوسُونُونِ وَالْمَا كَانَارُ مُوسُونُونِ وَالْمَا كَانَارُ مُوسُونُونِ وَمُوسُونُونِ وَمُوسُونُونِ وَمُوسُونُونِ وَمُوسُونُونِ وَمُوسُونُونِ وَمُوسُونُونِ وَمُوسُونُونَ مُنْ وَسِرِ مُنْ مُنْ وَسِرِ مُنْ مُنْ وَسِرِ مُنْ مُنْ وَسِرِ وَمُوسِونِ وَسِرَقُونُ وَسُرِي وَالْمُنْ وَسُرِقُ مُنْ وَسِرِ مُنْ وَسِرِ وَمُؤْسِونِ وَسُولِ وَسُولِ وَالْمُؤْمِ وَالْمُونِ وَلِي وَالْمُونِ وَلِي وَالْمُونِ وَلِي وَالْمُؤْمِ وَلِي وَلِي مُنْ وَسِرِ مُنْ وَسِرِ مُنْ وَسِرِ وَالْمُؤْمِ وَلِي وَالْمُؤْمِ وَلِي وَالْمُؤْمِ وَالْمُونِ وَلِي وَالْمُؤْمِ وَلِي وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَلِي وَالْمُؤْمِ وَلِي وَالْمُؤْمِ وَلِي وَالْمُؤْمِ وَلِي وَالْمُؤْمِ وَلِي وَالْمُؤْمِ وَلِي وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُوالِمُوا وَالْمُوا وَالْمُوالِمُوا وَالْمُوالِمُولِ وَالْمُوالِمُولِ وَالْمُوالِمُوا وَالْمُوالِمُولِ وَالْمُوالِمُولِ وَالْمُولِ وَالْمُولِ وَلِي وَالْمُوالِمُولِ وَالْمُولِ وَالْمُولِي وَالْمُولِ وَالْمُولِ وَالْمُولِ وَالْمُولِي وَالْمُولِ وَالْمُولِ وَالْمُولِي وَلِي وَالْمُولِي وَالْمُولِي وَالْمُولِي وَالْمُولِي
 - 1.10 سَرُوكِسُ دُورِ دُرُوْكُ عِنَى رِسَرُدُ كَسُرْسُورُ دُغِنَى رِسُوسُ مِرْدُ وَلَوْسُرُوسُورُ دُغ

3-3 -3 -3 -3

- 3.1.1 ورُسَّمَ وَوَی سَهُوْسُ وَسَهُرَامُوْ مَنْسِرُو اَ مَرْسُرُو اَ مَرْسُرُ اللهِ مَرْسُرُ اللهِ مَرْسُرُ اللهِ مَرْسُرُ اللهِ مَرْسُرُ اللهُ اللهِ مَرْسُرُ اللهُ اللهِ مَرْسُرُ اللهُ الله
 - 3.1.2 دُوْرَمُ مِ مُرَدُدُ سَوْفَ رُ وَسَوْمَ مُ مُرْمُ مُرْمُ وَرُدُورُ
 - 3.1.3 دُرُهُ الْمُؤْوَّةُ وَلَا مُرْتَارِ رَجِّتُو دُوْوِرُوسُ وَالْمَاشَى سُرْتَا مُوْسُرُ.
 - 3.1.4 و مرگری مرکوش کا مرکوش مرکزیش
- 3.1.5

 ۵.1.5

 ۵.1.5
 - 3.1.6 وْمْرُوْدُ مُنْكُورِ دُرْوْدُرِ صَّرُو مُرْوَحُ مِرْمُورُ مُنْ وَرُوْرُورْ.
 - 3.1.7 رُدُخ وْوَرُّه بِوْرْ وْوَتْ مُورِ مُرْوَتْكُونْكُونْ وْرِدْسْ خَرِدْسْ مُسْرِسْ 2 وْوَتْ.

4- څېرونگر تريمرد:

- 6.2 ב'רקב'ם מ'קל'ב'ר מ'פ'יל ל'ל'קל'ם פ'יל ב'רמ'ל ב'רמ'ל ב'רמ'ל ב'רמ'ל ב'רמ'ל ב'רמ'ל ב'רב'ל ב

- 7.1 و دُسَمْرُهُ رُوَّرُوْنِ پِر مُرْهُوْ مُرْسِرُهُ مُرْمُودِ مِنْ بِرَمْرُهُ وَ مُرْمُونِ وَيُمْمُنَاوُهُ
- 7.2 המפצמ בְּהמָשׁ בְשׁתְ הְהַבָּאַמִּקְפָּא בְּתֹנֵּמְ בִּתְנֵּמְבְּאִי הְיִבְּבְּאַתְ הְיִבְּבְּאַתְ הְיִבְּ באבְרָהמָשׁ בְּשֹׁת בְּהַבָּאַ בִּאַבְּרָ בֹּאִהְבּרָבִיתִישׁ בּישׁה בָּאַבְּהְ בֹּאִהָּבּרְרבּיתִישׁ .

8- הניתנית עיתעית:

- 8.3- 8.3 8.3 8.3 6.3 <a href=